



જૂનાગઢ મહાનગરપાલિકા

દ્વારા આયોજીત



एक कदम स्वच्छता की ओर

હાફ મેરેથોન દોડ - ૨૦૨૦

રન ફોર ક્લીન - જૂનાગઢ

પ્રવેશપત્ર

સ્પર્ધા તારીખ
૨ - ફેબ્રુઆરી, ૨૦૨૦



રેગ્યુલર ડીપોઝીટ ફી
રૂ.૨૦૦/-
સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે
ડીપોઝીટ રૂ.૧૦૦/-
જે સ્પર્ધા રમાયા બાદ પરત આપવામાં આવશે.

| દોડ ૨૧ કિ.મી. | જન્મ વર્ષ | અહીં ટીક કરવી |
|-------------------------------------|----------------------|--|
| રન ફોર ક્લીન જૂનાગઢ ૧૦ કિ.મી. | U-17 18-39 40+ | કોઈપણ ઉમરના ૨૦૦૩ પછી જન્મવાળા ૨૦૦૨ થી ૧૯૮૧ ૧૯૮૦ પહેલાના જન્મવાળા કોઈપણ ઉમરના કોઈપણ ઉમરના |

| ટી-શર્ટ સાઈઝ |
|--------------|
| 30 |
| 32 |
| 34 |
| S/36 |
| M/38 |
| L/40 |
| XL/42 |
| XXL/44 |

ભાઈઓ

બહેનો

✓ ખરી નિશાની કરવી.

જે સ્પર્ધા ભાગ લેવો તેમાં ✓ ખરી નિશાની કરવી.

અટક

નામ

પિતાનું નામ

૧) સ્પર્ધકનું પુરૂ નામ (ગુજરાતી) : _____

પુરૂ નામ(અંગ્રેજી)(કેપીટલ અક્ષર) _____

૨) પત્ર વ્યવહારનું પુરૂં સરનામું : _____

૩. મોબાઈલ : (૧) _____ (૨) _____

૪. Whatsapp No. _____ ૫. જન્મ તારીખ : _____

૬. વિદ્યાર્થી હોય તો શાળા અને ધોરણ : _____

૬) જન્મ તારીખ માટે કોઈપણ આધાર/પુરાવો :- _____

૭) ભવિષ્યની યોજનાર અમારી સ્પર્ધાની જાણકારી આપના ફોન તથા વોટસઅપ નં. પર મેળવવા માંગો છો :- હા / ના

OFFICE USE ONLY



નોંધ : ફોર્મની ઝેરોક્ષ પણ સ્વીકારવામાં આવશે.

-: સ્પર્ધકનું સંમતિ પત્ર :-

આથી હું આ નીચે સહી કરનાર સ્પર્ધક મારી લેખિત સંમતી આપું છું કે, હું જાતે મારી રાજીપુશીથી અને ઈચ્છાથી આ સ્પર્ધામાં મારા જોખમ અને જવાબદારીએ જોડાઉં છું સ્પર્ધા દરમ્યાન મને અથવા મારાથી કોઈને કોઈપણ પ્રકારના અકસ્માત-નુકશાન/ઈજા કે જાનહાની થાય તો તે અંગેની આયોજકની જવાબદારી રહેશે નહીં. આવી સઘળી જવાબદારી મારી પોતાની અંગત રહેશે. સમગ્ર સ્પર્ધાના નિતિ-નિયમો અને શરતો/સુચનાઓ વાંચી સમજ્યા છે. જેનું પાલન કરીશ તથા તે પૈકી કોઈ નિયમ/શરત ભંગ થયાનું જાહેર થાય તો કોઈપણ સમયે મને સ્પર્ધામાંથી બાકાત કર્યા અંગેના સ્પર્ધા દરમ્યાન કે સ્પર્ધા પછીના આયોજકોના નિર્ણયને ખેલદિલી પૂર્વક સ્વીકારીશ અને તે મને માન્ય રહેશે. તથા કોઈપણ બાબતે વાદવિવાદ કરીશ નહીં.

તારીખ :

સ્પર્ધકની સહી,

-: વાલીનું સંમતિપત્ર :-

આથી હું શ્રી _____
રહેવાસી(ગામ) _____ આથી મારી લેખિત સંમતી આપું છું કે, આ સ્પર્ધામાં મારા પુત્ર/ પુત્રી/આશ્રીત
શ્રી / કુ. _____ તેની રાજીપુશીથી આ સ્પર્ધામાં જોડાવા માગે છે
તેને હું મારી આથી લેખિત સંમતી આપું છું. આ સ્પર્ધા દરમ્યાન અમારા પુત્ર/પુત્રી/આશ્રીત સ્પર્ધકને કોઈપણ પ્રકારનો
અકસ્માત / નુકશાન થાય તો તે અંગે આયોજકોની કોઈપણ જવાબદારી ગણાશે નહીં.

સ્થળ :-

તારીખ :-

(વાલીની સહી તથા પુરૂં નામ)

**સરકારી પ્રાથમિક સ્કુલ/હાઈસ્કુલના વિદ્યાર્થી માટે
આચાર્યશ્રીએ આપવાનું પ્રમાણપત્ર**

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી/કું _____

અમારી શાળામાં ધોરણ _____ માં અભ્યાસ કરે છે અને તેના જી.આર. મુજબ તેની જન્મ તારીખ _____ છે
અને જુનાગઢ મેરેથોન દોડ સ્પર્ધા ૨૦૨૦માં ભાગ લેવા આ શાળા પ્રમાણપત્ર આપે છે.

નોંધ : સરકારી શાળાઓ એ જ આ પ્રમાણપત્ર આપવું.

(આચાર્યશ્રીની સહી તથા સિક્કો)

આપની સ્પર્ધા-ગમત તથા અન્ય કોઈપણ લગતી સિધ્ધી

આ સ્પર્ધામાં આપની સાથે પરિવારના સભ્યોએ ભાગ લીધો હોય તો તેની વિગત

સ્પર્ધાની માહિતી તથા નિયમો (આ કાગળ સ્પર્ધકે રાખવો.)

- 1) ડિપોઝિટ અને ફી ની વિગત:- આ દોડ સ્પર્ધા માં કોઈ પણ પ્રકાર ની ફી રાખેલ નથી. માત્ર વ્યવસ્થા ના ભાગ રૂપે તમામ દોડ માટે ડિપોઝિટ રૂ. 200/- લેવા માં આવશે અને સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ડિપોઝિટ રૂ. 100/- રાખવા માં આવી છે. તે સ્પર્ધા પૂરી થયા બાદ ચેસ્ટ નંબર જમા કરાવ્યા બાદ પરત આપી દેવા માં આવશે.
- 2) ઓનલાઈન ફોર્મ ભરનાર સ્પર્ધકો ચેસ્ટ નંબર લેવા આવે ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર સાથે લાવવો અને ડીપોઝિટ રૂ. 200/- જમા કરવાની રહેશે.
- 3) સ્પર્ધા રૂટ :- તમામ સ્પર્ધા ની શરૂવાત જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ભવનાથ. સામે ના ગ્રાઉન્ડ પાસે થી કરવા માં આવશે. આમ છતાં હાલ રૂટ માં કોઈ ફેરફાર હશે તો ચેસ્ટ નંબર અને ટી શર્ટ લેવા ના સમયે દરેક સ્પર્ધકને રૂટ ના નકશા ની નકલ આપવા માં આવશે. અન્યથા અગાઉ થી જાણકારી આપવા માં આવશે.
- 4) સ્પર્ધા સમય :- 21 કી.મી. (હાફ મેરેથોન) રિપોર્ટિંગ સમય 5:30 કલાકે શરૂવાત સમય 6:00 કલાકે 10 કી.મી. (રન ફોર ક્લીન જૂનાગઢ દોડ) ફન રન, તથા મીની ફન રન રિપોર્ટિંગ સમય 6:30 કલાકે શરૂવાત સમય 7:00 કલાકે
- 5) વિભાગવાર વિજેતા હરીફોને નિયત પારિતોષિક અને પ્રમાણપત્ર આયોજકો તરફથી આપવામાં આવશે. ઉપરાંત કોઈ પ્રોત્સાહક ઈનામો જે તે વખતે જાહેર થશે તો તેવા સંબંધકર્તા સ્પર્ધકને આવા ઈનામો આપવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સંસ્થા તરફથી ટી-શર્ટ, મેડલ તથા માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે.
- 6) હાફ મેરેથોનનાં પ્રથમ 10 વિજેતાઓને તથા રન ફોર ક્લીન જૂનાગઢ (10 કી.મી.) નાં પ્રથમ પાંચ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, તથા ફન રન માં રોકડ પુરસ્કાર રાખવામાં આવેલ નથી.
- 7) જૂનાગઢ મુકામે તેમના પોતાના ખર્ચે પહોંચવાનું રહેશે. આ સ્પર્ધામાં પવેશવાની કોઈ વિશેષ અલગથી જાણકારી કરવામાં આવશે નહીં.
- 8) સ્પર્ધા પૂર્વે કે સ્પર્ધા દરમ્યાન કોઈપણ સ્પર્ધકે કોઈ પ્રકારના માદક પદાર્થ કે ઉત્તેજક પીણાંનો ઉપયોગ કરી શકાશે નહીં, જો તેમ કર્યાનું જાહેર થશે તો આવા સ્પર્ધકને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે તેમજ પછીથી હકીકત જાહેર થયેથી વિજેતા પદ મેળવેલ હશે તો પણ વિજેતા પદેથી દૂર કરવામાં આવશે.
- 9) સમગ્ર સ્પર્ધા દરમ્યાન કોઈ વાહનની કે અન્ય કોઈ સહારા વિના પુર્ણ કરવાની રહેશે.
- 10) જે તે વિભાગ માટેના આપનાર નિયત ચેસ્ટ નંબરો રહેશે અને સ્પર્ધકે આગળ દુરથી દેખાઈ તે રીતે સુચનાર અનુસાર ચેસ્ટ નંબરો સમગ્ર સ્પર્ધા દરમ્યાન લગાવી રાખવાના રહેશે.
- 11) સ્પર્ધકોએ યુનિફોર્મ (ટી-શર્ટ) પહેરીને જ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
- 12) સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકે તેમની ડાબી બાજુએ જ ચાલવાનું રહેશે તથા કોઈ સ્પર્ધકને ઓવરટેક કરવાના થાય ત્યારે તેમણે અડચણ કર્યા વગર તેવા સ્પર્ધકની જમણી બાજુએથી અન્ય કોઈ હરીફ તેમને ઓવરટેક કરતા હોય ત્યારે તેવા હરીફને સરળતા કરી આપવી તથા કોઈ પણ જાતનો અવરોધ કરવો નહીં.
- 13) સ્પર્ધા પુર્ણ કર્યા બાદ જે તે સ્પર્ધકે તેમને આપવામાં આવેલા ચેસ્ટ નંબરો તુરત જ જમા કરાવી આપવાના રહેશે. ચેસ્ટ નંબર જમા કરાવી પોતાની ડિપોઝિટ પરત મેળવવા ની રહેશે. ચેસ્ટ નંબર જમા નહીં આવેલ હોય તેવા સ્પર્ધકોએ સ્પર્ધા વચ્ચેથી છોડી દીધી હોવાનું ગણી નિર્ણય કરવામાં આવશે.'
- 14) આ સમગ્ર સ્પર્ધા સાહસિક છે તેમ છતાં આ સ્પર્ધા માં જે તે સ્પર્ધકે તેમની પોતાની અને તેમના વાલીની ઈચ્છા અને સંમતિથી સ્પર્ધકોએ પોતાના જોખમે જોડાવવાનું રહેશે. સ્પર્ધા દરમ્યાન કોઈ સ્પર્ધકને સ્પર્ધક દ્વારા અન્ય કોઈને નુકશાન/અકસ્માત/ઈજા કે જાનહાની થાય તો તે અંગેની આયોજકોની કોઈ જવાબદારી રહેશે નહીં.
- 15) આ સ્પર્ધા માટે શારીરિક રીતે યોગ્ય હોય તેવા સ્પર્ધકે એ જ ભાગ લેવા કોઈ સ્પર્ધકને અગાઉ કોઈ મોટી ઈજા થઈ હોય, શારીરિક કે માનસીક ખોડાખાપણ હોય, અકસ્માત કે હાડકા માંગેલા હોય કે દોડ ના લીધે શ્વાસોશ્વાસ તકલીફ થતી હોય, બ્લડ પ્રેશરના દર્દી હોય અથવા હૃદય નબળું હોય, ચક્રકર આવતા હોય, તેવી વ્યક્તિઓએ આ સ્પર્ધામાં ભાગ લેવો નહીં. આમ છતાં આવી હકીકત છુપાવી સ્પર્ધામાં જોડાયા હશે અને તેવા સ્પર્ધકને કોઈ અકસ્માત થશે તો તે અંગેની આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- 16) સ્પર્ધાના વિજેતા અંગેના નિર્ણયકો દ્વારા થનાર નિર્ણયોને ખેલદીલી પુર્વક સ્વીકારવાના રહેશે. અને તે અંગે કોઈ વાદ-વિવાદ કરી શકાશે નહીં.
- 17) વિતરણ સમારોહ પુરો થયા બાદ આ સ્પર્ધા અંગેના કોઈપણ પ્રકારના આક્ષેપ-પ્રતિઆક્ષેપ કે વાદ-વિવાદ કરી શકાશે નહીં.
- 18) પ્રવેશપત્ર માંગ્યા મુજબની પુરી હકીકત સ્વચ્છ અક્ષરોમાં ભરી સાથે સામેલ કરવાના દરેક સાધનિક કાગળો તારીખ :-25/1/2020 સાંજ સુધીમાં નીચેના સરનામે રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.
- 19) કોઈપણ સ્પર્ધકે એક કરતા વધારે સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
- 20) તમામ સ્પર્ધા માટેના સાધનો જેવા કે શુઝ, શોર્ટ્સ વગેરે જાતે વ્યવસ્થા કરી લાવવાના રહેશે.
- 21) ફોર્મની ઝેરોક્ષ પણ ચાલશે. અને ફોર્મ સાથે આધાર કાર્ડ /જન્મ તારીખ દાખલો /લીવીંગ સર્ટિ /લાયસન્સમાંથી કોઈપણ એકની ઝેરોક્ષ આપવાની રહેશે.
- 22) તમામ દોડ સ્પર્ધા માટે એક જ ફોર્મ રહેશે.
- 23) તમામ સ્પર્ધા તા.02/02/2020 રવિવારના રોજ રહેશે,
- 24) તારીખ : 31/1/2020 અને 1/2/2020, શુક્રવાર અને શનિવાર ના રોજ સવારના ૧૦ થી સાંજે ૪ સુધી ગુજરાત સ્પોર્ટ્સ ખાતેથી ચેસ્ટ નંબર તા.
- 25) 5000 સ્પર્ધાર્થી વધારે તમામ સ્પર્ધકને ફન રન માં જ એન્ટ્રી મળશે. જેમાં પોતાની અનુકૂળતા મુજબ ડ્રેસ પહેરી શકશે.
- 26) શાળામાંથી એકી સાથે એન્ટ્રી કરાવનાર શાળાએ પોતાના શિક્ષક પાસેથી એકી સાથે ટી-શર્ટ અને ચેસ્ટ નંબર અગાઉથી લઈ જવાના રહેશે. વિદ્યાર્થીઓને ટી-શર્ટ તથા ચેસ્ટ નંબર લેવા અલગ અલગ મોકલવા નહીં.
- 27) સંસ્થા તરફથી ભાગ લેતા સ્પર્ધકોની એન્ટ્રી તા.-25/1/2020 સુધી જ સ્વીકારવામાં આવશે અને તેના ચેસ્ટ નંબર અને ટી-શર્ટ તા.: 28/01/2020, સુધી અગાઉથી સંપક કરી મેળવી લેવાના રહેશે.
- 28) તારીખ : 2/2/2020, રવિવાર ના રોજ સ્પર્ધા તારીખે કોઈપણને ટી-શર્ટ અથવા ચેસ્ટ નંબર આપવામાં આવશે નહીં. જેની સ્પર્ધકે ખાસ નોંધ લેવી.
- 29) ઇનામ ની રકમ, સ્પર્ધા તારીખ, સ્પર્ધા સમય માં આયોજક દ્વારા ફેરફાર કરી શકાશે તેમ કોઈ વાંધો ઉઠાવી શકશે નહિ.

ફોર્મ લેવા / પરત કરવાનું સ્થળ

સાયકલીંગ એસોશીએશન જિલ્લા જૂનાગઢ

C/o ગુજરાત સ્પોર્ટ્સ

પહેલા ગાળો, સંવાદ કોમ્પ્લેક્સ, એ.બ્રુ.સ્કુલ સામે, જૂનાગઢ મો.૯૯૯૮૩ ૪૭૭૧૧

વધુ સંપર્ક માટે : ૮૭૩૩૦ ૫૦૧૧૧, ૯૪૨૯૨ ૭૮૬૮૯, ૯૯૦૯૬ ૮૯૯૪૫